## K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE: DESHNA CHAMBERS, B/H. KADVA PATIDAR VADI, USMANPURA, ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE: 079-27543200

CIN L 65910 GJ 1986 PLC 008864

01st February, 2019.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: 511728

Dear Sir,

Sub.: Newspaper Advertisement of Financial Results for the Quarter ended 31st December, 2018.

Ref.: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirement)
Regulations, 2015

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Financial results for the quarter ended 31st December, 2018, as published in the Newspaper in English as well as Gujarati language.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED

Pravinkumar Patel Managing Director (Din: 00841628)

· sicevin

Encl: as above

## વવીવ આસાકાર તામુલ કામદુવ્રી મૃદિક ઉમ્રગબિક માટાકાવા ભારકાલ તામું કારતીક ગામ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મહાદેવ પ્રામ-બાકરોલ નજીક આવેલ રાજપુર ગામે અતિ પ્રાચીન ભગવાન દાદકાધીશના અવતાર રામદેવજીના નવીન આકાર પામેલ મંદિરે ઉમંગભેર રિદિવસીય પ્રાણ પ્રતિખ્ઠા મહોત્તવ યોજાશે, જેની મહિનાઓથી તડામાર તે ત્યારીઓને એત બક્તા અને શ્રદ્ધાભુઓના સાથ સલકાકરથી હવે તેને અતિમ રૂપ આપી દેવાયું છે. શ્રી રામદેવજી સેવા સૌમીત, રાજપુર, શ્રામભતી તથા સમસ્ત

રાજપુર, શ્રી બાકરોલ લક્ત મંડળ, રાજપુર, શ્રી બાકરોલ લક્ત મંડળ, રામજનો તથા સમસ્ત રામદેવજી ભક્તો દ્વારા આયોજિત આ ગિદિવસીય પ્રાણમંત્રિષ્ઠા મહોત્સવનો મોટલે આવુલાને સાંધા સુદ એકમે મંગળવારે તા.પ/ર/ ૨૦૫૯ ના રોજ સ્તારે ૮-૩૦૩ કહાં ક્રાર્યભ થશે, સવારે ૯-૬લાં ક્રેપ્ટ મંત્ર મંત્ર પ્રત્યેશ ૧૧૨૦ કહાં ક્રેપ્ટ મંત્ર મંત્ર પ્રત્યેશ ૧૧૨ કહાં ક્રેડ પૂજન ૧૨ કહાં ક્રેડ પૂજન ૧૨ કહાં કે, હેપ્પૂજન ૧૨ કહાં કે, હેપ્પૂજન ૧૨ કહાં કે, હેપ્પૂજન ૧૨ કહાં કે, હેપ્પૂજન ૧૨ કહાં કે, હોપ્પુજન ૧૫ કહાં કે, હોપ્પુજન હોપના સાંજ ૪ કહાં કે, હોપના પ્યાપ્ય પ્રત્યા કહેં પ્રત્યા કહેં હોર્ય કહાં કે, હોપ્પુજન હોપના પ્યાપ્ય પ્રત્યા કહેં પ્રત્યા કે હોર્ય કહાં કે, હોપ્પુજન હોપના હોપના કહેં હોર્ય કહાં કે, હોપના હોપના કહેં હોર હોપના હોપન શાયનપૂજન સાંજે ૫ કલાકે અને આરતી સાંજે પઃ૩૦ કલાકે થશે.

અવસ્તા સાજ પઃ૩૦ કલાક થશ. જયારે પુછ્યકારી હિતીય દિવસ તા. દ?/૨૦૧૯ ના રોજ પ્રાતઃ પૂજન સવારે ૮:૩૦ કલાકે, મૂર્તિ શાભાયાત્રા સવારે ૧૧:૨૦ કલાકે, શાભિ પીરિક હોમ સવારે ૧૧:૩૦ કલાકે, જલાધિવાસ બપોરે ૩ કલાકે , મહા સ્તપન પ્રયોગ



બપોરે ૩ઃ૨૦ કલાકે, ધૃતાધિવાસ સાંજે ૫ કલાકે, ધાન્યધિવાસ સાંજે ૫ઃ૧૫ કલાકે,ન્યાસ પકરણ સાંજે ૫ઃ૩૦ કલાકે, શયનાધિવાસ સાંજે

કલાકે અને અને મહા આરતી બપોરે ૪.૧૫ કલાકે થશે.જેના આચાર્યપદે શશિકાન્ત શાસ્ત્રીજી,મોડાસા ,ઉપ આચાર્ય

શાસ્ત્રીજી, મોડાસા, ઉપ આચાર્ય અચિવકુપાર એમ.પંડ્યા,જીતપુર તથા કર્મ આચાર્ય વિપુલભાઇ ગિવેદી, ઇડર છે. આ મહોત્સવના મંગલ અવસરે સંતો-મહંતો પધારીને આશીર્વેલન પાઠવરી, આ મહોત્સવ ઉજવાવ જનજનમાં અને ભક્તાંમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ દિવસોમાં લાખોનો મહેરામાણ ઉમટી પડનાર હોઈ તેના માટેની સથળી વ્યવસ્થાઓ માટે સેવભાવી સ્વયંસેલ એ ને મુમાશઓ. સ્વંયસેવકો અને મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓ ખડેપર્ગ સેવા

## સેલવાસ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ શાળામાં ૭૦મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ



સેલવાસની લાયન્સ ઈંગ્લીશ મીડીયમ શાળામાં ૭૦માં ગેલકાંત્ર દિવસની ઉજવણી ધૂમધામાંથી કરવામાં આવી લતી. આ પ્રસંગે મુખ્ય ભતિવિ વિશેશ દરેના હત્યે પજ કરલાવમાં આવી લતી. આ પ્રસંગે મુખ્ય શાળાના વિદ્યાર્થીઓ અને સ્કાઉટ ગાઈડ ફારા પરંડને સલામી આપી હતી. વિધિ ક કરતાં ફારા દેશમાં એકતા અને વસ્ત્યમાં સંદશો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગતવર્ષના ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પ્રમાણય આપી સમાનિત કરવામાં આવ્યા હતા. દાનહમાં અને અન્ય રાજ્યમાં વિવિધ સ્પર્યાઓમાં વિજેતા બનેલા શાળાના વિદ્યાર્થીઓ વર્ષા કરવામાં અપાયા હતા. ત્યારબાદ શાયરે વિલાગાં મોલી વર્ષ દરયાના સ્વામાં ને દ્રિતામાં ગ્રાય આવેલ તેમને ટ્રોકી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના ચેરમેન કન્સરિસ લાંગ્રોલી વર્ષા દરયાના સ્વામાં આવ્યા હતા. આ અવસરે લાયન્ય અને દેશના શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. આ અવસરે લાયન્ય હત્ય બા કો સ્વેશના ચેરીટેબલ ટ્રસ્ટના અથકા કર્માદીકાર ઔદ્યારા રસ્ટીયળ, આચાર્ય પી ધનશેખરન. વાઈસ પ્રિન્સિયાલ નિરાલી પારેખ, શિક્ષકગલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ★ ച്പുപാപി പ്രാഹ ഗ്രൂപ്പില ചിടിവച ചന്നുച്ച് എവ

## ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર

(પ્રતિનિધિ) હરસોલ, સામરકાંઠાનાં પ્રતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં અહી જાદના ખેલ ચાલી રહ્યા છે છે કે અહી જાદુર બીજું કોઈ નહી પણ અહીના વિદ્યાર્થીઓ જે છે. આદ્રા..લા. માં પ ફૂટ ઊંચે ઉઠી રહેલી આ વિદ્યાર્થીઓ જે છે...સા...લા માં પ ફૂટ ઊંચે ઉઠી રહેલી આ વિદ્યાર્થીનો તેની જ મિત્રએ હવામાં પ ફૂટ જાદુર્થી ઉઠી કરી છે. જાલીને નવાઈ લાગશે પણ આ શાળાનાં પચાસ રકાથી વધુ વિદ્યાર્થીઓ જાદુરાર છે. અને તેઓ કોઈ પણ મોટી જાદુરાર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાદે છે. વાત જાશે એમ છે કે અહીના આચાર્ય અને એમો તેના કરી કર્યું કે શાળાના બાળાકને કોઈ નુક રતબ કરી જાદે છે. વાત જાશે એમ છે કે અહીના આચાર્ય અને એમો તેના કોઈ કર્યું જાદુના ખેલ સ્ત્રીખ વિદ્યાર્થીઓ સા તરકી કર્યું જાદુના ખેલ વાત જાશે એમાં તે કરી કર્યું જાદુના ખેલ વાત જાદે એમાં તે કરી કર્યું જાદુના ખેલ વાત જાદે એમા તે કરી કર્યું જાદુના ખેલ વાત જાદે એમાં તે કરી કર્યું જાદુના ખેલ વાત જાદે તે હતા તે કરી હતા તે હતા



જીન તેઓ કોઇ પણ માટા જૂદ્ધાર કરી શકે છે... ખાવા....કોં થળીમાંથી બાળકને બાળકો ના કરી શકે એવા કામ અને ગાયબ કરવું.....એર, સ્વાગત માટે કે મોલા કામ અને ગાયબ કરવું.....એર, સ્વાગત માટે કે કે શાળાના બાળકોને કોઇ નવું તો એકથી એક ચરીયતા જુદ્દા કે શાળાના બાળકોને કોઇ નવું તો એકથી એક ચરીયતા જુદ્દા કરતા શીખવવામાં આવે. અને ખેલ આ બાળકો કરી જુદ્દો છે... સામા-ય રીતે સરકારો કર્યું જુદ્દા માં ખેલ સાં આ બાળકો કરી જુદ્દો છે... જુદ્દાનો પાયાસો પણ આ બાળકો હોય છે કે... જે કે યુનાદરા ગામની ઇન્ટરનેટ, સાયન્યના શિશકો, જુદ્દાના માપ્યાસો પણ આ બાળકો હોય છે કે... જુદ્દાનો પાયાસો પણ આ બાળકો હોય છે કે. જો કે યુનાદરા ગામની ઇન્ટરનેટ, સાયન્યના શિશકો, જુદ્દાના માપ્યાયો કરી શકે છે.... પૂનાદરા ગામની વેચાનને પાયાસો માર્ય કરતા સાળાનો શિશકોએ જે કરી બતાવ્યું અને લોકોની કળા સહીત વિજ્ઞાનની માર્ટ કરતા લોકોની આપ્રિક કરિયાદ કરતા સાળાનો શિશકોએ જે કરી બતાવ્યું અને લોકોની કળા સહીત વિજ્ઞાનની માર્ય કરતા સાળાનો સાળામાં આ અગામી સમયમાં તેમને નોકરી સ્ત્રામની માર્ચ કરતા સાળાનો માર્ચ કર્યા કરે અને માર્ચી સ્ત્રામની માર્ચ કરતા સાળાનો સાળામાં માર્ચ કરાય તાલીનો માર્ચ કરતા સાત્રામની સાળામાં માર્ચ કરાય તાલીનો માર્ચ કરતા સાત્રામની સાળામાં આ ગામ કરાય ના સાળામાં તેમને નોકરી અનાવો ... સ્ત્રામને તામને નોકરી સાત્રામાં સાત્રામ તેમને માર્ચી સાત્રામ સાત્રામાં તેમને નોકરી અનાવો ... અગામાં સમયમાં તેમને નોકરી બાવાવો ... અગામાં સાત્રામાં સાત્રામ નોકરી સાત્રામાં સાત્રામ તેમને માર્ચી સાત્રામ સાત્રામાં તેમને નોકરી ... માર્ચી કરાય કરતા સાત્રામાં તેમને નોકરી બાવાવો ... અગામાં સાત્રામાં તેમને નોકરી ... માર્ચી અગામ મળવી ... અગામાં સાત્રામ સાત્રામાં સાત્રામ ના સાત્રામાં સાત્રામ મળવી ... અગામાં સાત્રામ મળવી ... માર્ચી સાત્રામ મળવી ... માર્ચી સાત્રામ મળવી ... માર્ચી સાત્રામ મળવી ... માર્ચી ... માર્ચી મળવી ... માર્ચી ... માર્યી ... માર્ચી ... મ

# અરવલ્લી જીલ્લા સેવા સદન કચેરીમાં અરવલ્લીમાં સકાઈ કામદારોના ન્યાય માટે ૨૪ કલાકના પ્રતીક

## હવે આવનાર સમય ફિઝિકલ, બીહેવિરીચલ બાચોમેટ્રિક્સનો

## ઉપવાસ બાદ દંડવત પ્રણામ સાથે કલેક્ટરને આવેદનપત્ર

(પ્રતિનિધિ) મોડાસા, ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અરવલ્લી જીલ્લા સે વાસદનના કાર્યક્ષેત્રમાં આવેલી અને જીલ્લાની કાર્યક્ષેત્રમાં આવેલી અને જીલ્લાની અન્ય સરકારી કરી સીઓમાં કાંન્ટ્રાક્ટ પહૃતિ થી સકાઈ કમંચારીઓની ભરતી માં સકાઈ કમંચારીઓની લા અન્યાય એંગે જલ્લા સે વાસદન કચંચી સામે ખુલ્લામાં સકાઈ કમંચારીઓ ૨૪ કલાક પ્રતીક ઉપતામ સંવશ મારી અબતે દંડવત પ્રશાસ માર્ચ "મારે અન્યાર સાથે ધારકાશના સથળ થી! સરકાર મુદાંબાદ સુદાંબાદ" ના નારા સાથે ધારકાશના સથળ થી! જીલ્લા કલેક્ટર એપા નાગરાજનને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપ્યું હતું મોડાસાના શામળાજી રોડ પર

મોડાસાના શામળાજી રોડ પર આવેલા જલ્લા નેવાસદન કચેરીના સ્થળ થી સામેની ખુલ્લી જગ્યામાં ગુજરાત વાસ્મિકી સંગઠન ના સહયોગ થી જલ્લાની સરકારી કચેરીમાં આઉટસોસક્ષગ થી ભરતી કરેલા સકાઈ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટર દ્વારા શોપણ થતા બુધવારે ૨૪ કલાકના પ્રતીક

કવેરીઓ, સ્વેચ્છીક સંસ્થાઓ શાળા કોલેજો સહીત જાહેરસ્થળો અને માગોં પર સરકારી અધિકારીઓ અને ભાજપના કાયંકરો કારો સેશન સાથે મોટી મોટી સકાઈ અને સ્વચ્છતા અંગે સુક્રિયાલી સલાહ આપવામાં આતે છે પરંતુ તે દેખાલો માત્ર થોડા દિવસો પુરાતો અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાતો હોય છે વાસ્તવમાં અપ્રપાલ કેટલીય સરકારો કર્યે સીઓમાં સરકારના કર્મચારીઓ હારા જ ગંદકી

ઉપવાસ યોજી ગુરુવારે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી દંડવત પ્રણામ સાથે આવેદનપત્ર આપનાર પ્રકામ સાથે આવેદનપત્ર આપનાર લાલજી ભગતે જીલ્લા કલેક્ટરને લાલજી ભગતે જે જ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે સકાઈ અમદારોના દ મહિનાથી પગાર પક્ષ કોન્ટ્રાક્ટરે આપેલ નથી જેથી સકાઈ કર્મચારીઓને જીવનનિવાંદ આલવામાં ભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાં છે સરકાર ના ધારાયોરણ સુજબ લધુત્તમ વેતન અમલવારી કરવા, પી. એક નો લાભ અલવારી કરવા, પી. એક નો લાભ

આપવા અને લાભાર્થી યાદીમાં સમાવિષ્ટ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી સફાઈ કરવાની માંગ કરી હતી સકાઈ કમદારોનો પરતર પશ્ચેનો ડેગ્લ કમદારોનો પરતર પશ્ચેનો ડેગ્લ કેલ નહિ આવેતો જીલ્લા સેવાસદનમાં ઉંચ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સકાઈ કામદારોના પ્રતીક ઉપવાસને લાલ વાવટાના અને ગરીબો અને જરૂરિયાત મંદ લોકો માટે સતત લડત ચલાવનાર ડાહ્યાબાઈ જાદવ અને તેમની ટીમે સમર્થન આપ્યું હતું.★

હોવાછતાં લિફ્ટમાં મસાલા ખાઈ ગ પિચકારીઓ થી થયેલી ગંદકી

ાજલ્લાના વાત કરવાના સવાલ જ નથી ઉભો થતો. સરકારી બાબુઓ માત્રને માત્ર વાર-તહેવારે જ તાયફા કરીને વાહવાહી લઇને ફાઇલ બતાવી દે છે, પણ જમીની હકીકત કચારે બદલાશે તે કોઇ



અરવલ્લી જુલ્લાના મોડાસાનાજે.સી. જી હોલ ખાતે મુસ્તફાચૌહાણઅને નાસીરભાઈ અંસારી બંને ટેલીફોન કર્મચારીઓની વચ મર્ચાદા પૂર્ણથતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ટેલીફોન વિભાગના સહ કમ્યર્રિટી ,અધિકારીઓઅને નિવૃત્તકર્મીઓના સ્નેહીજનો ઉપસ્થિત રહે નિવૃતકર્મીઓ,તંદુરસ્તજીવનજીવેઅનેલાંબાદીદ્યશ્રુમાટેપ્રાર્થનાકરી હતી.(તરવીર:-ઇકબાલ ચિસ્તી,મોડાસા)

## અમરેલી જિલ્લામાં ૯૮૪૯ મતદારોનો વધારો

ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પરથી કચેરી

ટાલ ક્ષે નંબર ૧૯૫0 પરથા કચરા સમય દરમ્યાન મતદાર નોંધણી,મતદાર મથક, નોંધણી અધિકારી જેવી તમામ જાણકારી તેમજ કોઇ સુચન કે ફરિયાદ પણ જણાવી શકાશ.

અમરેલી, અમરેલી, અમરેલી (જિલ્લાના અમરેલી લોક સભામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિસ્તાર ૮૪ મારી, ૯૫-અમરેલી, ૯૨-અલાઠી, ૯૦- સાવત, લેંગ્યા, ૯૮- રાજુલ વિધાનસભા મત વિસ્તારની મતદારસાઠી, પ્રતિભ્રમિની વિગતો પ્રેસ કોન્ફરન્સને આપના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલે કરરાશી આપણ ઓક જાલાવું હતું કે લોક શાહીના આ મહાપવમાં કોઇપણ લાયક વ્યક્તિ પોતાના કોઇપણ લાયક વ્યક્તિ પોતાના

તે માટે લોક જાગૃતિના શક્ય તમામ પ્રયત્નો વહીવટી તંત્ર દ્રારા કરવામાં પ્રયત્ના વહાવટા તંત્ર દ્રારા કરવામાં આવેલ છે. ઓકે વધુમાં જણાવ્યું હતું કુંધારી વિધાનસભા મત વિસ્તારમાં ૧૬૪૨, અમરેલીમાં ૧૬૮૦, હાઠીમાં ૨૦૪૨, સાવરકુંડલામાં ૧૬૪૨ અને રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં ૨૮૪૩ મળીને કુલ

AREX INDUSTRIES LIMITED

CIN: L99999GJ1989PLC012213 Regd. Office: 612, GIDC Estate, Chattral, Tal.:Kalol, Dist.: Gandhinagar – 382 729, Gujarat, India Phone: 02764-233437 Email: mail@arex.co.in

NOTICE

INDO-GLOBAL ENTERPRISES LIMITED nond Grand, Nr. Torrent Power S.S,100 Ft. Rd, Makai d - 380051 Gujarat, TEL: +91 79 40034010/26305550 doglobalinc.in, Email: compliance.indoglobal@gmail.e 85PLC007814 NOTICE Notice is hereby given that the Meeting of the Board on Directors of the Company will be held on 13th February 2019 at 4:00 P.M at Registered Office of the Company

inter – alia, to consider and approve un-audited Financial Results of the Company for the quarter ended on 31st December, 2018 as per Regulation 33 of SEBI Regulations.

Place : AHMEDABAD Date : 01.02.2019

For AREX INDUSTRIES LIMITED Dinesh A Bilgi (DIN: 00096099) Managing Directo

For INDO GLOBAL ENTERPRISES LIMITED

કોઇપણ લાયક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે

ામના ઉત્કેદ નહિ. ૯૮૪૯ જેટલા મતદારો નો અમરેલી જિલ્લામાં વધારો થયેલ છે. તેમકો વધુમાં જજ્ઞાવ્યું હતું કે, ગ્રામ્ય વસ્તારમાં ૧૨૦૦ મતદારો અને શાંદરી વિસ્તારોમાં ૧૪૦૦ મતદારો દીઠ મતદાન મથકોને ધ્યાને લઇ જિલ્લામાં કું હતુ નવા ૧ ૧ નવા મતદાન મથકો ઉમેરાયેલ છે. જેમાં સાવર ફુંડલામાં ૦૫, રાજુલામાં ૦૧ મતદાન મથકનો વધારો થયેલ છે. કલેક્ટરએ મતદાન સલાયતા કેન્દ્ર અને ટોલ ક્રી નંબર ૧૯૫૦ની વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયતાં તમામ તાલું હતું કે, આગામી સમયતાં તમામ તામ તાલું હતું કે, આગામી સમયતાં તમામ તાલું હતું આ પ્રેસ કોન્કરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આ ૨.જી. આ લ , ચૂંટણી મામલતદારશ્રી બગસરિયા,શ્રી અધ્યારૂ સહિત વિશાળ સંખ્યા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનાગઢ : ભરણ પોષણની

. રકમ ન ચૂકવનાર પતિ જેલમાં ઘકેલાચો **જૂનાગઢ,** જૂનાગઢના જોષીપરામાં રહેતી કે,આગામી સમયમાં તમામ તાલુક મથકોએ મતદાન સહાયતા કેન્દ્ર કાર્યરત કરી દેવામાં આવશે.અને

જૂનાગઢના જાષાપરામાં રહતા નીતાએન સખાણીના લગ્ન અમરેલીના ક્રુટના વેપારી મુરલી રમેશભાઈ બદલાણી સાથે થયા હતાં. કોઈ કારણોસર વાંધો પડતા તે પિયરમાં રિસામણે આવી હતી. પતિ ાપવરમા ારસામણ આવા હતા. પાત આવે ભરણ પોષણનો દાવો માંડતા અદાલતે પ્રતિ માસ રા.૪૫૦૦ મંજૂર કર્યા હતાં. પરંતુ મુરલી બદલાણીએ માર્ચથી ઓગસ્ટ ચાર માસની ખાધા ખોરાકીની ૨કમ ન ચુકવતા કોર્ટમાં દાદ માંગી હતી. ન્યાયાધીશે આરોપીને કોર્ટમાં હાજર રાખી પૂછતા ચડત રકમ ચુકાવવા અસમર્થ હોવાનું જણાવતા ૪૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.

ડો.એસ.એસ. વૈશ્ચએ અમદાવાદમાં આચોજીત ટીબી નાબુદી સેમિનારનું કરેલું ઉદ્ઘાટન



પુષ્પતાનું ગુજરાત મેં ડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ કે.ડી. હોસ્પિટલ ખાતે ટીબી નાબુદી પહેલ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું ગુજરાત મેડિકલ એસોસિએશન પ્રમુખ અને પદ્મશ્રી

ડો.એસ.એસ. વૈશ્યએ ઉદ્દાઘટાન કર્યું હતું. આ સેમિનારમાં ડો. બિપીન પટેલ, ડો.મહેન્દ્ર દેસાઇ, ડો.પાર્થ દેસાઇ, ડો.યોન્ડન મોદી, ડો.પાર્થુલ દેસાઇ, ડો. કેમલેશ સેની, ડો.મહેન્દ્ર ચૌપદી, ડો. મચીડા, ડો.તુષાર પટેલ સાહિત અનેક નામાંકિત ડોક્ટરોએ ભાગ લીધો હતો. ★

### લેસ્ટર્ન ટાઇસ્સ

આજેપણ કેટલીય સરકારી કચેરીઓમાં સરકારના કર્મચારીઓ કારા જ ગંદકી કરવામાં આવતી હોય છે અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીના ખૂલાઓ, ભારીઓ, લિફ્ટપાનની પ્રિયકારીઓ મારી કર્મચારીઓ અને કામકાજ અર્થે આવતા પ્રજાજનો મારતા દીવાલો અને ખૂલાઓ ગંદકીથી ખદબદી રહ્યા છે જીલ્લા સેવાસદનની

**વેસ્ટર્ન ટાઇમ્સ**માં પ્રકાશિત જાહેરાનો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કર<u>ી</u> નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

નામ બદલેલ છે મેં મારૂ નામ **અમીરા હીન્દુજા** હતું તે બદલીને **નિર્દ્યા હીન્દુજા** રાખેલ છે. સરનામું : ૧, હીરાબાગ સોસાયટી, વસંતનગર પાછળ, નણીનગર, અમદાવાદ-૩૮૦૦



## યુનીફોસ એન્ટરપ્રાઈસીઝ લીમીટેડ

CIN:L24219GJ1969PLC001588

રજી.ઓફિસઃ ૧૧, જી.આઈ.ડી.સી., વાપી, જિલ્લોઃ વલસાડ - ૩૯૬ ૧૯૫, ગુજરાત

	ત્રિમાસીકના અંતે			નવ મહિનાના અંતે		વર્ષના અંતે
વિગતો	39.92.209८	30.06.2096	39.92.2096	39.92.209८	39.92.2096	39.03.209८
	અનઓડીટેડ	અનઓડીટેડ	અનઓડીટેડ	અનઓકીટેક	અનઓકીટેક	ઓડીટેડ
કામગીરીમાંથી કુલ આવક	-	-	-	-	-	
કર અને અસાધારણ વસ્તુઓ પહેલાંના		1				
સમયગાળા માટે ચોખ્ખો નકો / (ખોટ)	(34.09)	२,०४१.उ२	98.8€	२,०१२.३७	9,926.83	1,203.20
કર પછીના સમયગાળા માટેનો ચોખ્ખો નફો (નુકસાન)	(४५.०७)	2,026.62	૧૩.૨૧	1,696.39	1,924.12	1,986.60
આ સમયગાળા માટે કુલ વ્યાપક આવક મકરના સમયગાળા માટે (કર બાદ)	1	'			'	
અને અન્ય વ્યાપક આવક (કર બાદ) માટેનુંવળતર નકો	२४,१६३.८८	૧૩,૪૨૫.૮૫	(3,693,63)	૯,૬૨૪.૪૫	10,661.26	२,3२०.२०
ઇક્વિટી શેર કેપિટલ	1,360.63	1,360.63	1,360.63	1,360.65	9,360.63	1,360.63
શેર દીઠ કમાણી (દરેક રૂ. ૨ / -)	1.	l .			'	l .
મૂળભૂત અને મંદ (રૂ. દીઠ શેર) (વાર્ષિક નથી)	(0.0€)	૨.૯૨	0.02	૨.૮૫	૨.૫૭	૨.૫૪

રુપાયુંના અને સ્ટ્રિટ સિમાસીક ગામ માટેના નાલાકીય પરિશામોનું સેબી રેચૂલેશન ૩૩ના (લીસ્ટીંગ એન્ડ અપર રિક્લોઝર્સ ફિકલાયરમેન્ટ્ર) રેચૂલેશન્સ, ૨૦૧૫ પેઠળ સ્ટ્રીક એક્સ્પેન્જમાં કાઈલ કરવામાં આવ્યું છે, ત્રિમાસીક ગામાનું નાશાકીય પરીશામોનું સંપૂર્ણ લોમ્દ્રે કંપની લેખલાઇટ www.uelonline.com પર તેમજ સ્ટ્રેક એક્સ્સેન્જ (સ્ટ્રેક કંપોએન્ડ લીસીટ (બીનેસર્ઇ)ની લેબ્લાઇટ www.bseindia.com તેમજ નેવાલ સ્ટ્રોક એક્સચેન્જ ઓક ઇન્ડિયા લિ. (એન્એસઈ)ને લેખલાઇટ www.uelonline.com પર ક્રાપ્ય એક લેખ્સ લિ. (એન્એસઈ)ને લેખલાઇટ : www.nseindia.com પર પ્રાપ્ય છે, જ્યાં કંપનીના ઇક્સીટી શેરો લીસ્ટ કરવામાં આવેલ છે. ત્રીક: ઓડિ સ્ટિલિક લાઇ વરોકન અનઓરિટેડ નાશાકીય પરિશામોની સમીશા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ બોર્ડ ઓક દિરેક્ટર્સને બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્થળ : મુંબર્ઇ તારીખ : ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૯

ચુનીફોસ એન્ટરપ્રાઈઝ લીમીટેંડ વતી રજનીકાન્ત દેવીદાસ શ્રોફ ચેરમેન અને મેનેજીંગ કિરેક્ટર કીન : ૦૦૧૮૦૮૧૦



VODAFONE IDEA LIMITED

Place: Mumbai Date : 31" January, 2019

!dea

K.Z. LEASING AND FINANCE LIMITED CIN: L65910GJ1986PLC00864 egd. Office: 1st Floor, Deshna Chambers, Behind Kadwa Patida Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: (079) 27543200 Email: kzleasing@yahoo.com EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

	ENDED 31	/12/201	8.	(Rs. in Lacs)		
Sr No		Quarter ended 31/12/18 Unaudited	Quarter ended 31/12/17 Unaudited	9 Months ended 31/12/18 Unaudited	Year ended 31/03/18 Audited	
3 4	Total Income from Operations (net) Net Profit / (loss) from ordinary activities before tax Net Profit/ (loss) for the period after tax Equity Share Capital (Shares of Rs. 10/- each)	18.62 (0.63) (0.63) 304.12	16.44 4.16 4.16 304.12	59.13 4.91 4.91 304.12	100.34 14.41 14.41 304.12	
5	(Shares of ins. 107-each) Reserves (excluding Revaluation reserve as shown in the Balance Sheet of Previous year) Earnings per share (before extra ordinary items) (of Rs 107-each)	-		-	-	
7	- Basic - Diluted Earnings per share (after extra ordinary items) (of Rs 10/- each) - Basic	(0.02) (0.02)	0.14 0.14	0.16 0.16	0.44 0.44 0.44	
	- Dasic - Diluted	(0.02)	0.14	0.16	0.44	

tes: (1) The above results were Reviewed by the Audit committee and taxen to ord by Board of Directors of the Company at its meeting on 3101/2019. To ove results have been reviewed by the Statutory Auditors of the Company. The above is an extract of the detailed format of Journatry financial result of with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation of Disclosure requirements) Regulation 20.51. The full format of financial result available on the Company's website www.kzgroup.in and Slock Exchang hoths www.beainfi.gcm?

For, K. Z. Leasing & Finance Ltd. sd/-Pravinkumar K. Patel (DIN-00841628)

# Cook reveals why iPhones not selling in emerging markets like India lower than the 2017 ship-ments of 3.2 million units. "We can expect some kind of price correction go-ing forward as Apple has given indications that they will look at pricing outside the US closely now, "Tarun Pathak, Associate Director at Counterpoint, told IANS. "India continues to be a critical market for Apple as premium segment is likely to grow faster than the over-all smartphone market," he added.

New Delhi,
Although Apple CEO
Tim Cook skipped mentioning India directly during the
company's earnings call
with analysts, he stressed
that there are several factors
why iPhone sales are not
picking up in the emerging
markets.
The customers are
holding on to their older
iPhones a bit longer than in
the past.

iPhones a bit longer than in the past.
"When you pair this with the macroeconomic factors, particularly in emerging markets, it resulted in iPhone revenue that was down 15 per cent from last year," Cook told analysts late

year,"Cook told analysts late Tuesday.
"One of those factors, weak macro-conditions in some emerging markets, was significantly more se-vere than we originally fore-saw, especially in Greater China. weak macro-conditions in some emerging markets, was significantly more several new originally fore-saw, especially in Greater China.

That challenge was compounded by quarterly iPhone upgrades that were

lower than we anticipated,"
Cook explained.
Apple CEO said foreign
exchange is another key factor behind the slow iPhone
sales.
The relative strength of
the US dollar has made our
products more expensive in
many parts of the world.
"The foreign exchange
issues amplified that difference in international markets, in particular, the
emerging markets which
tended to move much more
significantly versus the dollar," he said.
According to him, subsidy is probably the bigge
of the issues in the developed markets.

"Third is our battery replacement programme. For
millions of customers, we
made it inexpensive and efficient to replace the battery
and hold onto their existing
iPhones a bit longer," Cook
explained.

Apple has already begun reducing the price of

may follow the same in India where the iPhone is considered very expensive. In a recent interview to CNBC, Cook said India is an important market for him. "It is a major focus. If you look at how we've done over the years, we've gone from, you know, \$100, \$200 mile to the company of the cook at how we've done over the years, we've gone from, you know, \$100, \$200 mile the cook of the duties and so forth that are put on the products to go away. And we're working closely with the team there, he added.

The iPhone maker is seeking tax relief and other incentives from the government to begin assembling more handsets and open its branded stores, and its proportion in the sale of the power of the cook of the coo

to grow faster than the over-all smartphone market," he added. In a fillip to Cook's big future plans for the Indian market, Apple has ap-pointed Ashish Chowdhary, chief Customer Operations Officer at Nokia Networks, as its India operation head. The decision to hire Chowdhary is a testament to the fact that Apple is alm-ling for a really long-term growth in a price-sensitive market where Apple is an aspirational brand and usu-ally bought by those who

## New facts emerge about lending to Zee

New Delhi,
New Facts have
emerged at the recent
lenders
organised with Zee management. It has emerged
that promoters loans directly or indirectly against
the security of their listed
Zee Entertainment shares
stand at over Rs 13,000
crore, adding to the
group's liability pis: Mutual Funds Rs 7,000 crore;
MSFCs/Banks Rs 4,000
crore; Offshore lenders Rs
2,000 crore.
As per stock exchange
filings, three Mauritiusbased entities in the promoter group hold 12.5 per
cent stake in Zee Entertainment. They are Essel
Media Ventures Ltd 10.7
per cent, Essel holdings
0.2 per cent and Ease International 1.5 per cent, all
of them forming part of
promoter holding of 41.6
per cent.
As per the filings, these
Mauritius entities-held
shares are unencumbered
but promoters have told
Indian lenders the same

are not available for being provided as security for Indian lenders. Hence, the current Zee Ent security value to Indian lenders is Rs 9,000 crore against Ioans Rs 11,000 crore - which is obviously a huge deficit. The Mauritius-held shares are directly or indirectly providing security for Rs 2,000 crore offshore loans raised by promoters in the past. No stock exchange disclosure has been made on any encumbrances/restrictions on Mauritius held shares but the same are clearly restricted in some manner - else it is unthinkable that Indian lenders facing a huge shortfall in security cover would not demand these additional shares to make up the cover. Annual interest liability on loans against pro-

up the cover.
Annual interest liability on loans against promoters' shares is at over Rs 1,100 crore for which there is no apparent source for payment other than Zee Entertainment cash flows.

## 90% car purchase in India is digitally driven: Report

Digitalisation is transforming the automobile purchasing culture in India with around 90 per cent buyers decision being digitaly influenced, an annual report by Google and market research firm Kantar INS said on Tuesday. Tracking people's car research and purchase journey in the country, the "Dive to Decide 2018" report claimed that 90 per cent search, 80 per cent videos and 56 per cent dealer-websites were the key digital touch-points that played a crucial role in influencing a car buyer's decision in India.

In the last two years, buyers researching online

have increasingly become more certain about the brand they want to purchase with instances of brand-switching declining from 11 per cent in 2016 to seven in 2018.

rom I i per cent in 2016 to seven in 2016 to Videos now not only act as a platform for automobile discovery but also as a con-sulting zone for buyers that allow them to explore cars from different perspectives. "From just searching for manufacturers and dealers online, buyers today are ac-tively looking for videos to answer their questions around car features to re-views to vehicle perfor-mance and more, 'said'Vikas Agnihotri, Country Director - Sales, Google India. Over the last two years,

about cars via online videos, 52 per cent visited the dealer, 45 per cent sched re-quested a price quote and 27 per cent further re-searched finance and lease offers. Apart from searching for vehicle pricing, 41 per cent users typically looked for maintenance programs, 37 per cent browsed for pro-motional offers, 35 per cent found routes to locations and directions to dealerships and 32 per cent also focused on reviews and recommendations, the re-port said.

## Karnataka eyes investments, jobs in electric vehicles segment

aspirational brand and usu-ally bought by those who have high spending power or can go for older genera-tion phones for affordability.

Bengaluru,
Tech-savvy Karnatak
would offer incentives to atrate thuge investments inrate thuge investments inrate thuge investments inrate thuge investments inrate thuge investments infelly, generate jobs and opportunities for research intiste most in research intiste most investments work
Wednesday "Kaminstea offers incentives to manufacture electric vehicles in thestate which has potential tostatract investments worth
Rs 31,000 crore in the sunrise sector, create over
55,000 direct jobs and proyolde opportunities for research and development
(R&D) in electric mobility,"
said Karnataka Industries
Minister KJ. George at a
summit on EVs.
As the first state in the

Taiwan-based Teco Elec-tric Company president George Lien said his firm would work with Kamataka government to bring in technology to make EVs as it was in the business of en-ergy optimization in India. South Korean Wevio president Calvin Yi said his global firm was signing an agreement with the Indian Chamber of Commerce (ICC) for setting up a joint venture and exchange tech-

country to have a policy to encourage use of eco-friendly electric vehicles with zero emission, George sold thave signer when the control of the control of

work with central and state governments across the country to attract investments and generate jobs in the EV sector."We plan to bring a delegation of EV and charging station makers from Japan, South Korea and Taiwan, which have a vibrant EV manufacturing ecosystem," added Singh.

## US dollar falls as Fed keeps interest rates steady

Reeps interes:

New York,

The US dollar sild on Wednesday, as the US Federal Reserve decided to keep interest rates unchanged and pledged patience in future policy making on interest rates a district of the patience in future policy making on interest rates a district of the federal days and the signal making on interest at the signal funds rate at 2-1/4 to 2-1/2 per cent, "the Federal Open Market Committee (FOMC) said in a statement, after it wrapped up its two-day policy meeting. In late New York trading, the euro rose to \$1.1481 from \$1.1421 in the previous session, and the firitish pound increased to \$1.3112 from \$1.3100 in the previous from \$1.1421 from \$1.3100 in the previous session, and the America Market Committee of \$1.3112 from \$1.3100 in the previous session, and the America Market M

ADARSH PLANT PROTECT LIMITED

trates steady
ous session. The Australian
dollar rose to \$0.7254 from
\$0.7148, Xinhua reported.
The US dollar bought 108.93
Japanese yen, lower than
109.27 Japanese yen of the
previous session. The US
dollar slid to 0.9941 Swiss
franc from 0.9950 Swiss
franc, and it fell to 1.3148
Canadian dollars 'from
1.3283 Canadian dollars 'from
1

ence after the FOMC meeting on Wednesday. Investors have expected that the Fed's interest rate hikes this year would be less than the four times it undertook in 2018. That would possibly increase the money flow in global financial markets later this year, which makes the dollar less valuable compared with other currencies.

## Honor 'View20' available on Reliance Digital, My Jio stores

CHANGE OF NAME have changed my old name from AMEERA HINDUJA to New Name NIDHI HINDUJA Add.: 1, Hirabag Society, B/h. Vasantnagar, Maninagar, Ahmedabad-380008

Reliance Digital, My Jio stores

New Delhi,
Chinese handset
maker Honor on Thursday,
announced that its new
flagship smartphone
Honor View20' would be
available across Reliance
Digital and My Jio
Stores
There are over 700 ReLance Digital and My Jio
stores and with this exclusion
aims attenship, Honor
aims are the service of the company said in a statement.
The partnership with
Reliance enables us to
reach a larger audience
which allows the end-customer to experience the
View20' smartphone
across India and make an
informed choice," said

WESTERNTIMES

## WESTERN TIMES Disclaimer

"WESTERNTIMES" does not stand responsible for the sales proposition.

## INDO-GLOBAL ENTERPRISES LIMITED

CIN: 174026J1885PLC07814 NOTICE
NOTICE
Notice is hereby given that the Meeting of the Board of Directors of the Company will be held on 13th February 2019 at 4:00 PM at Registered Office of the Company inter—alla, to consider and approve un-audited Financial Results of the Company for the quarter ended on 31st December, 2018 as per Regulation 33 of SEBI Regulations Regulations.

For INDO GLOBAL ENTERPRISES
LIMITED BHARAT SONI COMPANY SECRETARY Place : AHMEDABAD Date : 01.02.2019

Development Corporation Limited

Handioum Technology Insidue, Nr. Mahatama Tempal,
Sector-13, Gandhinapar Phonesia, 1979) 23241712223247033,

https://gurjari.gujarat.gov.in / Email: contact@gurjari.co.in
TENERN NOTICE
FOR MIC FOR COMPUTERS AND PRINTERS
Tender are invited for AMC for Computers and printers
lying at Corporation's various branches within Gujarat State.
Interested parties may visit website: https://gurjari.gujarat.gov.in and down load the tender
documents on 21.2.2019 at 17.00 Hours. The last date for
physical submission of tender is on 23.2.2019 at 17:00 hrs
along with tender fee & EMD cover, Technical Bid and Financial
bid covers separately.

Managing Director Managing Directo



Gujarat State Handloom & Handicrafts Development Corporation Limited

D-904, Richmond Grand, Nr. Torrent Power S.S.,100 Ft. Rd, Makar Ahmedabad - 380051 Gujarat, TEL: +91 79 40034010/26305555 (eb.: www.indoglobalinc.in, Email: compilance, indoglobal@gmail.o CIN: L70102GJ1985PLC007814

AREX INDUSTRIES LIMITED

CIN: L99999GJ1989PLC012213

CIN: L99999GJ1989PLC012213

CIN: L99999GJ1989PLC012213

CIN: L99999GJ1989PLC012213

CIN: L9999GJ1989PLC012213
Regd. Office: 612, GIDC Estate, Chattral, Tal.:Kalol,
Dist.: Gandhinagar – 382 729, Gujarat, India
Phone: 02764-233437 Email: mail@arex.co.in

NOTICE

For AREX INDUSTRIES LIMITED

(DIN: 00096099) Managing Directo



Drinking Water Supply
Gujaral Jalseva Training Institute (GJTI). Gujaral Water Supply &
Sewerage Board, Sardar Patel Road, (G-Road), Sector-15,
Gandhinagar, invites E-Enden from experienced contractors who
qualify as per technical & financial criteria mentioned in tender
documents for Procurement of I.S, Valás for the year of 2019-20'
Tender Estimate Cost Rs 30.24 Lakhs, EMD Rs 30,240'. Tender
Fee Rs 1500'. Last date of on-line submission of tender in
15.02.2019 up to 18.00 his. The detailed tender notice and tender
document are available on website: www.nproure.com. Board
odcument are available on website: www.nproure.com. Sorden
See the right to reject any or all tenders without assigning any
feason.

Mahitt2780/Ha-19.

Mahiti/2769/18-19

### Chief Officer

Notified Area Office, GIDC office Compound, Oppo Police Outpost, Sarigam, Ta. Umargam, Dist. Valsad-396155 Ph. 0260-2780326

(Re-invited)
Tender Notice No. 04 of 2018-2019
Tender for works having estimated cost Rs 28.02
lakhs are invited by the Notified Area Officer, Sarigam.

NNO On Line | To downloading of the on-line tender from the web site www.rnpocure.com from 04 (22 (29) to 15 (26) 29) to 17 (20) the, and uploading shall be upen 16 (22 (29) to 15 (26) 29) to 17 (20) the, and uploading shall be upen 16 (20) to 17 (20) the 17

without assigning the reason thereof is reserved with

Chief Officer, NA, Sarigam

## K.Z. LEASING AND FINANCE LIMITED CIN : L65910G J1986PLC00864 Regd. Office : 1st Floor, Deshna Chambers, Behind Kadwa Patic Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone : (079) 27543200 Email : kzleasing@yahoo.cor

one: (079) 27543200 Email: kzleasing@yahoo.

EXTRACT OF STANDALONE UNAUDITED

FINANCIAL RESULTS FOR THE QUARTER

ENDED 31/12/2018. (Rs. in

S		Quarter	Quarter	9 Months ended	Year ended
ľ	o .				
		31/12/18	31/12/17	31/12/18	31/03/18
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations (net)	18.62	16.44	59.13	100.34
2	Net Profit / (loss) from ordinary				
Ι-	activities before tax	(0.63)	4.16	4.91	14.41
3	Net Profit/ (loss) for the period after tax	(0.63)	4.16	4.91	14.41
4	Equity Share Capital	304.12	304.12	304.12	304.12
	(Shares of Rs. 10/- each)				
5	Reserves (excluding Revaluation				
	reserve as shown in the Balance				
	Sheet of Previous year)				
6	Earnings per share (before extra				
	ordinary items) (of Rs 10/- each)				
	- Basic	(0.02)	0.14	0.16	0.44
ı	- Diluted	(0.02)	0.14	0.16	0.44
7		l ' '			
ı	ordinary items) (of Rs 10/- each)	1			
	- Basic	(0.02)	0.14	0.16	0.44
	- Diluted	(0.02)	0.14	0.16	0.44

For, K. Z. Leasing & Finance Ltd. sd/- Pravinkumar K. Patel (DIN- 00841628)

## Business Brief III

Sanwaria Consumer reports growth of 70.6% in Net Profit for Q3FY19

Bhopal, Sanwaria Consumer Ltd. one of the fastest en 

pared to 18 2.00 cture, reported in previous year. Net Profit for Q3FY19 has increased by 70.6% at 84.28.0 crore, as compared to 18 25.08 crore reported in the same period previous year. The company reported ann EPS of 18 0.58 per share for the quarter ending 31st December 2018, which is significant as compared to 18 0.34 per share reported in 0.3FY18.

### Manpasand teams up with GEM Enviro to recycle the PET plastic bottles

to recycle the PET plastic bottles

Ahmedabad:

Manpasand Beverages Limited partnered with
GEM Enviro Management, one of the largest PET recycling companies in India, to support the
Government's initiative of EPR (Extended Producer
Responsibility) for plastic waste management. Under
this partnership, GEM Enviro will help Manpasand
Beverages with the necessary infrastructure to recycle the PET bottles in Maharashtra.

Commenting on this association, Abhishek Singh,
Director, Manpasand Beverages Limited sald, our
customer's health and wellbeing have always been
the foremost guiding principles at Manpasand.
Manpasand has alwayse mbraced every initiative that
has enhanced the customer's and the society's interest at large. Thus, we completely support and second
the government's vision of sustainable implementation of the plastic waste management and pledge to
create a healthier environment by thoroughly embracing and implementing this PET recycling initiative.

Mr. Singh also elaborated that after the success-

tive.

Mr. Singh also elaborated that after the successful implementation of the first phase of the said initiative in Maharashtra, Manpasand looks forward to implementing the programme across India, in the coming years. He also mentioned about how the company is working on other alternative sustainable packaging solutions that creates less waste and are completely recyclable, reusable and renewable.

### US Federal Reserve leaves interest rates unchanged

Washington,
The US Federal Reserve on Wednesday left interest rates unchanged, in line with market expectations, reaffirming its position to be patient with future rate likes. In support of the goals to foster maximum emi

## DHFL stocks continue to bleed,

Stocks of Dewan Housing Finance Corp (DHFL) plunged further on Thursday as its share prices fell 20 per cent after reports emerged that the Ministry of Corporate Affairs (MCA) may probe allegation of a Rs 31,000 crore scam.

Stock exchanges have also sought clarification from the company over reports of the likely probe. Around 10.20 a.m., the share price of DHFL on the National Stock Exchanges slumped nearly 20 per cent to touch an inter-day low of Rs 129.50.

At 1.36 p.m., it traded at Rs 138.25 per share, lower by Rs 23.20 or 14.37 per cent from the previous close. On Tuesday, the investigative media organisation of the company of the control of the contr

### Market surge on global cues, healthy Q3 results; Sensex up 665 pts

Mumbai,
Short-covering ahead of the monthly derivatives expiry along with a dovish US Fed outlook and healthy large-cap quarterly earnings result pushed the barometer BSE Sensex higher by 665 points on Thursday.
The MSE Nifty finished past the 10,800-mark gaining 1300 pairs.

Thursday.

The NSE Nifty finished past the 10,800 mark gaining 180 points.

Investors' sentiments were buoyed as global markets surged after the US Federal Reserve decided to keep the interest rates unchanged.

Consequently, the S&P BSE Sensex closed 665.44 points higher at 36,256.69, while the broader Nifty finished at 10,830.95, up 17,915 points.

"US FedS decision to keep the interest rates unchanged is good for the emerging markets, investors are also upbeat owing to the healthy Q3 results by large caps," Rusmik Oza, Head-Fundamental Research, Kotak Securities, told IANS.

"also the short covering ahead of the F&O expiry due later in the day gave a push to the markets."

Da said the upcoming interim Budget may not have a material impact on the markets because "It would just be announcements. Investors will focus on the July budget, which will be of muck greater in grant and should be some on the later of the points are under the past of the points are under the past of the points are under the past of the p